



સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)

વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે

મુમુક્ષુતા વર્ષ-૨

આવો લક્ષ્યાંકોની દંટતા કરીએ

મહારાજ અને મોટાપુરુષના સંકલ્પે સમગ્ર સમાજ મુમુક્ષુતાના માર્ગે આગળ વધે તે માટે ગત વર્ષને મુમુક્ષુતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ હતું એ જ રીતે આ વર્ષને મુમુક્ષુતા વર્ષ-૨ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુમુક્ષુતાની વધુ પુષ્ટી થાય તે માટે ચાર લક્ષ્યાંકો આપવામાં આવ્યા છે. આ લક્ષ્યાંકોનું પ્રેક્ટીકલ જીવનમાં અમલીકરણ થાય તથા તેનું મોટાપુરુષને વિશેષ પ્રમાણમાં પરિવર્તન દેખાય અને સમગ્ર સત્સંગ સમાજ મુમુક્ષુતાના માર્ગે આગળ વધે તે માટે પ.પૂ.સ્વામીશ્રીએ ખાસ નીચે મુજબની રૂચિ જણાવેલ છે.

પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ છે કે આ વર્ષનાં લક્ષ્યાંકો માટે લક્ષ્યાર્થતાના જે મુદ્દા નક્કી કર્યા છે તે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ઘર સુધી પણ પહોંચે અને સર્વે હરિભક્તોએ આ આકારે થવું.

ગુરુવર્ષ પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય નિમિત્તેની ઓછામાં ઓછી ૧૦ મિનિટ ધૂન કરવાનો તથા ૫ માળા કરવાનો સમગ્ર સમાજમાં પ.પૂ.સ્વામીશ્રીએ આદેશ આપ્યો છે તેનું પાલન કરવું. દરેક ઘરના સભ્યોએ ૧૦ મિનિટની ધૂન પછી આ મુમુક્ષુતા વર્ષ-૨ ના લક્ષ્યાંકો માટેના લક્ષ્યાર્થતાના જે મુદ્દાનું સમૂહમાં વાંચન કરવું અને તે મુજબ વર્તવાનું સતત અનુસંધાન રાખવું.

સમગ્ર સમાજમાં ચાર લક્ષ્યાંકોનો અમલ થયો છે કે કેમ? તેનો સમગ્ર સમાજમાં સર્વે થઈ શકે તેવા જ મુદ્દા નક્કી કરીને આપવામાં આવ્યા છે. જેનો સર્વે જુલાઈ તથા ઓક્ટોબર એમ બે માસમાં સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય દ્વારા કરવામાં આવશે.

❖ મુમુક્ષુતા વર્ષ-૨નાં લક્ષ્યાંકોના ફળ સ્વરૂપે સમગ્ર સમાજમાં રીઝલ્ટ લેવા માટે લક્ષ્યાર્થતાના મુદ્દાઓ

● લક્ષ્યાંક-૧ દાસાનુદાસ થઈને રહીએ.

- (૧) કોઈ દુઃખાય, દુભાય તેવું બોલીશ નહીં, ક્રોધ કરીશ નહીં તથા કોઈની ઉપર હાથ ઉપાડીશ નહીં.
- (૨) સવારે પૂજા કર્યા બાદ તથા પરિવારના સભ્યોને ચરણ સ્પર્શ કરી દયાળુ, રાજી રહેજો, જય સ્વામિનારાયણ કહીશું તથા રાત્રે સુતી વખતે પણ દયાળુ, રાજી રહેજો, જય સ્વામિનારાયણ કહીશું.

● લક્ષ્યાંક-૨ બહિર્મુખી મટી અંતર્મુખી બનીએ

- (૧) વ્યવહારને ગૌણ કરી મંદિરે નિત્ય દર્શન કરવા આવીશ તથા અઠવાડિક સભામાં ફરજિયાત હાજરી આપીશ.
- (૨) દિવસ દરમ્યાન મહારાજમાં જોડાવા ૨ કલાક સમય અવશ્ય કાઢીશ.

● લક્ષ્યાંક-૩ વખાણ નહિ, રોકટોક અને વટવું ગમાડીએ.

- (૧) ૨ સંતો અને ૨ સારા હરિભક્તો સાથે હેત કરીશ અને તે કહે તેમ કરીશ.
- (૨) નાના-મોટા જે કોઈ ભૂલ ઓળખાવે તેનો સહર્ષ સ્વીકાર કરી સુધારો કરીશ.

● લક્ષ્યાંક-૪ વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ.

- (૧) બિભત્સ ફોટોગ્રાફ, વિડીઓ તથા એવી વેબસાઈટનો ઉપયોગ કરીશ નહીં.
- (૨) બજારુ ખાણી-પીણીનો ત્યાગ કરીશ અને દિવસ દરમ્યાન ૧૫ મિનીટ ધ્યાન કરીશ જ.

આ ચારેય લક્ષ્યાંકોના કુલ આઠ મુદ્દાઓ SMVSના સમગ્ર હરિભક્ત સમાજના જીવનમાં ચરિતાર્થ થાય તે હેતુથી સમગ્ર વર્ષ દરમ્યાન નિત્ય આ આઠ મુદ્દાઓનું વાંચન, સ્વનિરીક્ષણ કરી કસરમુક્ત થવા પ્રયત્ન કરવો.